



HSBC Mutual Fund

વૈવિધ્યપૂર્ણ વિશિષ્ટતાઓ ધરાવતું ફંડ



પ્રસ્તૂત છે HSBC મલ્ટી એસેટ અલોકેશન ફંડ

(ઇક્વિટી અને ઇક્વિટી સંલગ્ન ઇન્સ્ટ્રુમેન્ટ્સ,
ડેબ્ટ અને મની માર્કેટ સિક્યુરિટીઝ અને
ગોલ્ડ/સિલ્વર ETFમાં રોકાણ કરતી એક ઓપન એન્ડેડ સ્કિમ)


બજારની તમામ
પરિસ્થિતિઓનો સામનો કરવા માટે.

NFO તારીખ:

8-22 ફેબ્રુઆરી 2024

એક પીઠ ખેલાડીમેદાનની પરિસ્થિતિ અને ફેંકેલા બોલમુજબપોતાના ભાથામાં રહેલાવિવિધ પ્રકારના શોટ્સ ફટકારી શકે છે. આજ રીતે, દરેક પોર્ટફોલિયોને જુદા-જુદા એસેટ ક્લાસની જરૂર પડે છે, જે જોખમ નિયંત્રિત કરવાની સાથે રિટર્ન પૂરું પાડવાની ક્ષમતા ધરાવે છે. તેવા ફંડની પસંદગી કરો જે ગ્રોથ પોટેન્શિયલ માટે ઇક્વિટીમાં રોકાણ કરે, જ્યારે બીજી તરફ સોનું/ચાંદી બજારની વોલેટિલિટીની પરિસ્થિતિમાં રિસ્ક બેલેન્સ કરવામાં મદદ કરી શકે છે.

કેટલીક મહત્વની ઘટનાઓ મારફતે એસેટ ક્લાસનો ઇતિહાસ



- બજારની સકારાત્મક પરિસ્થિતિઓ દરમિયાન ઇક્વિટી માર્કેટનું પ્રદર્શન ખૂબ જ મજબૂત જોવા મળ્યું છે પરંતુ સબ-પ્રાથમ, ચીનની મંદી અને કોરોના વાઈરસના કારણે વૈશ્વિક લોકડાઉન દરમિયાન તેમાં તીવ્ર ઘટાડો પણ જોવા મળ્યો હતો.
- આવી ઘટનાઓ દરમિયાન, એસેટ ક્લાસ જેમ કે ગોલ્ડ અથવા ડેબ્ટ અથવા સિલ્વર ઇક્વિટીના નેગેટિવ પરફોર્મન્સ સામે આવશ્યક વળતર પુરું પાડી શકે છે.

શ્રેષ્ઠ એસેટ ક્લાસમાં અવાર-નવાર ફેરફાર થાય છે

NIFTY 50 TRI દ્વારા સૂચિત ઇક્વિટી, NIFTY શોર્ટ ડ્યુરેશન ડેબ્ટ ઇન્ડેક્સ દ્વારા સૂચિત ડેબ્ટ અને સોનાની કિંમત (પ્રતિ 10 ગ્રામ), ચાંદીની કિંમત, Nifty 50 વેલ્યુ.

સ્ત્રોત: MFI એક્સપ્લોરર, ICRA, 31મી ડિસેમ્બર, 2023 સુધીનો ડેટા, સંબંધિત કેલેન્ડર વર્ષ માટે 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બરના સમયગાળા માટે એવરેજીયુટ રિટર્ન.

ભૂતકાળનું પ્રદર્શન ભવિષ્યમાં જળવાઈ રહે અથવા જળવાઈ ન પણ રહે અને તે ભવિષ્યના પરિણામો સૂચવતું નથી.

મલ્ટી એસેટ અલોકેશન

સ્ટ્રેટજી વિવિધતા પૂરી પાડે છે, વોલેટિલિટીનો પ્રભાવ ઘટાડે છે

Nifty 50 TRI દ્વારા સૂચિત ઇક્વિટી, CRISIL કમ્પોઝિટ બોન્ડ ફંડ ઇન્ડેક્સ દ્વારા સૂચિત ડેબ્ટ, MCX/ સ્પોટ ગોલ્ડ પ્રાઈઝ (PM) સૂચિત ગોલ્ડ (પ્રતિ 10 ગ્રામ), MCX/ સ્પોટ સિલ્વર પ્રાઈઝ (PM) સૂચિત સિલ્વર, મલ્ટી એસેટ સ્ટ્રેટજી = ઇક્વિટી (65%) + ડેબ્ટ (20%) + ગોલ્ડ (10%) + સિલ્વર (5%), 1, 2 અને 5 વર્ષ રોલિંગ ફિક્સન્સી/ વોલેટિલિટી સાથે ડેઈલી રોલિંગ પરફોર્મન્સ, વોલેટિલિટી = દૈનિક ભારિત વળતરનું વાર્ષિક માનક વિચલન, સ્ત્રોત: NSE, CRISIL, 31 ડિસેમ્બર, 2023 સુધીનો ડેટા. પ્રદર્શન પરિણામો પોતાની અંતર્હત મર્યાદાઓ ધરાવી શકે છે અને તેવી કોઈ રજૂઆત કરવામાં આવી રહી નથી કે કોઈ રોકાણકર્તા તે મેળવશે અથવા મેળવવાની સંભાવના છે.

ડેટાનો સમયગાળો 1 જાન્યુઆરી 2007થી 31 ડિસેમ્બર 2023.


ભૂતકાળનું પ્રદર્શન ભવિષ્યમાં જળવાઈ રહે અથવા જળવાઈ ન પણ રહે અને તે ભવિષ્યના પરિણામો સૂચવતું નથી.

રોલિંગ રિટર્ન	માપદંડો	મલ્ટી એસેટ સ્ટ્રેટજી	Nifty 50 TRI	ડેબ્ટ (100%)	ગોલ્ડ (100%)	સિલ્વર (100%)
1 વર્ષ	સરેરાશ	11.9%	13.0%	7.6%	13.2%	11.9%
	લઘુતમ	-38.0%	-55.4%	-0.5%	-17.3%	-29.9%
	મહત્તમ	73.4%	100.2%	15.8%	55.1%	159.7%
	વોલેટિલિટી	14.8%	22.9%	3.7%	15.1%	28.9%
3 વર્ષ	સરેરાશ	11.7%	12.1%	7.8%	11.5%	9.6%
	લઘુતમ	-0.1%	-4.5%	4.1%	-8.0%	-17.3%
	મહત્તમ	27.5%	32.4%	12.9%	35.4%	52.4%
	વોલેટિલિટી	3.9%	6.1%	1.8%	9.8%	15.7%
5 વર્ષ	સરેરાશ	11.0%	11.4%	8.0%	10.3%	6.8%
	લઘુતમ	2.3%	-1.0%	5.5%	-2.0%	-11.6%
	મહત્તમ	19.4%	21.8%	10.4%	28.5%	28.0%
	વોલેટિલિટી	2.5%	4.2%	1.1%	7.5%	9.9%

મલ્ટી એસેટ અલોકેશન પરિસ્થિતિ વાજબી જોખમ નિયંત્રિત પ્રદર્શન દર્શાવે છે.

ઓલરાઉન્ડર જે વોલેટિલિટીમાં પણ વૃદ્ધિ પામે છે

રજૂ કરી રહ્યાં છે – HSBC મલ્ટી એસેટ અલોકેશન ફંડ



ટૂંકા ગાળામાં જ્યારે ઇક્વિટીમાં રોકાણ જોખમી બની શકે છે ત્યારે તેઓ લાંબા-ગાળે સંપત્તિના સર્જનમાં પરિણમી શકે છે.

કેટલાક ડેબ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વોલેટિલિટીનો પ્રભાવ ઘટાડવાનો અને સ્થિર આવકનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે.

જ્યારે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ગોલ્ડ/સિલ્વર વોલેટિલિટીનો પ્રભાવ ઘટાડવામાં મદદ કરી શકે છે અને લાંબા ગાળે વૃદ્ધિને મદદ કરે છે.
અત્યંત વિપરિત સંજોગોના કિસ્સામાં, આર્બિટ્રેજ વોલેટિલિટી ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.

કાર્યક્ષમ એસેટ અલોકેશન સાથે HMAAF જોખમ ઘટાડવાનો, ઇષ્ટતમ પરફોર્મન્સ અને લાંબા ગાળામાં જોખમ નિયંત્રિત વૃદ્ધિ પૂરી પાડવા માટે જોખમ ઘટાડવાનો હેતુ ધરાવે છે.

મલ્ટી એસેટ અલોકેશન પરિસ્થિતિ વાજબી જોખમ નિયંત્રિત પ્રદર્શન દર્શાવે છે.

સ્ત્રોત – HSBC મ્યુચ્યુઅલ ફંડ, માત્ર પ્રદર્શનના હેતુ માટે

રોકાણ રણનીતિ – HSBC મલ્ટી એસેટ અલોકેશન ફંડ

ઇક્વિટી – 65%(લઘુતમ)થી 80% સુધી અલોકેશન

- તમામ માર્કેટ કેપ ધરાવતી કંપનીઓના પોર્ટફોલિયોનું સક્રીયપણે સંચાલન
- સામાન્ય રીતે ઇક્વિટીની ફાળવણી 65% થી 80%ની વચ્ચે હોઈ શકે છે (5% થી 10 % વિચલન)
- બજાર/ ફંડ હાઉસના એસેટ ક્લાસ આઉટલૂકમાં ફેરફારના આધારે એસેટ રિ-અલોકેશન હાથ ધરી શકાય છે.
- અભિગમ: મિશ્રિત – ટોપ ડાઉન + બોટમ અપ
- સ્ટાઈલ: મિશ્રિત: ગ્રોથ અને વેલ્યુ

ડેબ્ટ – 10% (લઘુતમ)થી 25%

- સામાન્ય રીતે ડેબ્ટ અલોકેશન આશરે 15% થી 20% રહેવાની સંભાવના છે (5% થી 10% વિચલન)
- એક્ટિવ ડ્યુરેશન મેનેજમેન્ટ ધરાવતાં આલ્ફાનું સર્જન કરવા માટે GOI સિક્યુરિટીઝ, કોર્પોરેટ બોન્ડ, મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ સહિત હાઈ ક્વોલિટી એસેટમાં રોકાણનો હેતુ
- બજારની ઉભરી રહેલી પરિસ્થિતિના આધારે અનુકૂળનશીલ ફેરફારો હાથ ધરવા સક્ષમ બનવા માટે લિક્વિડ પોર્ટફોલિયોના નિર્માણનો હેતુ
- કર્વના શોર્ટથી મિડિયમ એન્ડ ઉપર ફોકસ

ગોલ્ડ / સિલ્વર ETF – 10% (લઘુતમ) થી 25%

- ગોલ્ડ / સિલ્વર અલોકેશન આશરે 10% થી 15% રહેવાનું અનુમાન છે (5% થી 10% વિચલન)
- જ્યારે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે વધ-ઘટને સરભર કરવા અને ગોલ્ડ / સિલ્વર મારફતે લાંબા ગાળે ગ્રોથને સપોર્ટ કરવાનો હેતુ
- કર્વના શોર્ટથી મિડિયમ એન્ડ ઉપર ફોકસ

આર્બિટ્રેજ

- બજારની કેટલીક પરિસ્થિતિઓમાં અથવા જો માર્કેટ આઉટલૂક નેગેટિવ હોય તો મંદીની અસર ઘટાડવાના હેતુથી આર્બિટ્રેજ માટે ઇક્વિટી પોર્શનનો ઉપયોગ કરી શકાય છે.
- અત્યંત વિકટ સંજોગોના કિસ્સામાં આર્બિટ્રેજ વોલેટિલિટીનો પ્રભાવ ઘટાડવા અને એકંદર પરફોર્મન્સ સુધારવા માટે મદદ કરી શકે છે.

આ ફંડ એક ઇષ્ટતમ મલ્ટી એસેટ અલોકેશન ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીના લાભદાયક ઉપયોગનો હેતુ ધરાવે છે

સ્રોત – HSBC મ્યુચ્યુઅલ ફંડ,

નોંધ: કૃપા કરીને સ્ક્રિમના એસેટ અલોકેશન અંગે વધુ માહિતી માટે સ્ક્રિમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ (SID) ધ્યાનમાં લો.

HSBC મલ્ટી એસેટ અલોકેશન ફંડ શા માટે?

- કાર્યક્ષમ એસેટ અલોકેશન સાથે HSBC મલ્ટી એસેટ અલોકેશન ફંડ લાંબા ગાળે યોગ્ય રીતે જોખમ નિયંત્રિત વૃદ્ધિ પૂરી પાડવા માટે જોખમને મુખ્ય ત્રણ એસેટ ક્લાસ એટલે કે ઇક્વિટી, ડેબ્ટ અને ગોલ્ડ/સિલ્વરમાં વિભાજિત કરવાનો હેતુ ધરાવે છે.
- સામાન્યપણે HMAAFનું ઇક્વિટી અલોકેશન 65% થી 80%ની વચ્ચે હોઈ શકે છે.
- આ ફંડ મિશ્રિત એટલે કે ટોપ-ડાઉન + બોટમ-અપ અભિગમ અને મિશ્રિત ગ્રોથ અને વેલ્યુ સ્ટાઈલ ઇન્વેસ્ટિંગ અભિગમ અપનાવવાનો હેતુ ધરાવે છે.
- ફંડ ફ્લેક્સિબલ અભિગમ અપનાવશે અને પ્રવર્તમાન વેલ્યુએશન સુગમતાના આધાર પર સમગ્ર માર્કેટ કેપમાં રોકાણ કરશે
- ફંડનું જનરલ ડેબ્ટ અલોકેશન 10% થી 25%ની આસપાસ રહેવાની સંભાવના છે.
- એક્ટિવ ડ્યુરેશન મેનેજમેન્ટ ધરાવતા આલ્ફાનું સર્જન કરવા માટે GOI સિક્યુરિટીઝ, કોર્પોરેટ બોન્ડ્સ, મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ સહિત હાઈ-ક્વોલિટી એસેટ્સમાં રોકાણ કરવાનો હેતુ
- ફંડ બજારની વધ-ઘટ સરભર કરવા અને લાંબા ગાળે વૃદ્ધિને સપોર્ટ કરવા માટે ગોલ્ડ/સિલ્વર ETFમાં આશરે 10% થી 25 ફાળવણી કરવાનો પણ હેતુ ધરાવે છે
- ફંડ અત્યંત વિકટ સંજોગોના કિસ્સામાં વોલેટિલિટીનો પ્રભાવ ઘટાડવા અને એકંદર પરફોર્મન્સ સુધારવામાં મદદ માટે આર્બિટ્રેજના અવસરો તપાસી શકે છે.
- બજાર / ફંડ હાઉસના એસેટ ક્લાસ આઉટલૂકમાં ફેરફારોના આધારે એસેટ રિ-અલોકેશન હાથ ધરી શકાય છે

HMAAF વિવિધતા ધરાવતો ફંડ છે જે બજારની તમામ પરિસ્થિતિનો સામનો કરવાનો હેતુ ધરાવે છે

ફંડની વિગતો

રોકાણનો ઉદ્દેશ	ફંડનો હેતુ લાંબા ગાળાની મૂડી વૃદ્ધિનું સર્જન કરવાનો અને ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ડેબ્ટ અને મની માર્કેટ સિક્યુરિટીઝ અને ગોલ્ડ/સિલ્વર ETFમાં રોકાણ કરીને આપક ઊભી કરવાનો છે. જોકે, તેની કોઈ ખાતરી અથવા બાંહેધરી નથી કે સ્કિમનો રોકાણ ઉદ્દેશ હાંસલ કરવામાં આવશે.
બેન્યમાર્ક	S&P BSE 200 TRI (65%) + NIFTY શોર્ટ ડ્યુરેશન ડેબ્ટ ઇન્ડેક્સ (20%) + સોનાની ઘરેલું કિંમત (10%) + ચાંદીની ઘરેલું કિંમત (5%)
ફંડ મેનેજર	શ્રી ચીનુ ગુપ્તા (ઘરેલું ઇક્વિટી માટે), શ્રી દિપન પરિખ (ગોલ્ડ / સિલ્વર ETF), શ્રી મહેશ છાબરિયા (ફિક્સ ઇન્કમ માટે), શ્રી સોનલ ગુપ્તા (ફોરેન સિક્યુરિટીઝ માટે)

Reach us 1800 200 2434

Follow us on     

www.assetmanagement.hsbc.co.in


HSBC મલ્ટી એસેટ અલોકેશન ફંડ
(ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ડેબ્ટ અને મની માર્કેટ સિક્યુરિટીઝ અને ગોલ્ડ/સિલ્વર ETFમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ સ્કિમ)

આ પ્રોડક્ટ નીચેના લક્ષ્યાંક મેળવવા માંગતા રોકાણકર્તાઓ માટે અનુકૂળ છે:

- લાંબા ગાળે સંપતિનું સર્જન
- ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સિક્યુરિટીઝ, ફિક્સ ઇન્કમ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને ગોલ્ડ/સિલ્વર ETFમાં રોકાણ

પ્રોડક્ટ પોતાના માટે અનુકૂળ છે કે નહીં તે અંગે જો શંકા હોય તો રોકાણકર્તાએ તેમના નાણાકીય સલાહકારનો સંપર્ક કરવો જોઈએ

*Riskometer of the Scheme




Investors understand that their principal will be at Very High risk


બેન્યમાર્કનું રિસ્કોમીટર

S&P BSE 200 TRI (65%) + NIFTY શોર્ટ ડ્યુરેશન ડેબ્ટ ઇન્ડેક્સ (20%) + સોનાની ઘરેલું કિંમત (10%) + ચાંદીની ઘરેલું કિંમત (5%)


S&P BSE 200 TRI




NIFTY Short Duration Debt Index



Domestic price of gold



Domestic price of silver



NFO દરમિયાન નિયત કરેલ પ્રોડક્ટ લેબલિંગ સ્કિમ લાશણિકાઓ અથવા મોડલ પોર્ટફોલિયોના આંતરિક મૂલ્યાંકન ઉપર આધારિત છે અને જ્યારે વાર્તાવિક રોકાણ કરવામાં આવે ત્યારે ભૂતકાળના NFOથી અલગ હોઈ શકે છે. વધુ વિગતો માટે HSBC મલ્ટી એસેટ અલોકેશન ફંડના સ્કિમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ (SID) ધ્યાન પર લો

ભૂતકાળનું પ્રદર્શન ભવિષ્યમાં જળવાઈ શકે છે અથવા જળવાઈ ન પણ રહે અને તે ભવિષ્યના પરિણામો સૂચવતું નથી. સ્રોત: HSBC મ્યુચ્યુઅલ ફંડ, 31 ડિસેમ્બર, 2023 સુધીનો ડેટા.
મંતવ્ય વ્યક્તિગત છે અને વર્તમાન સમયમાં જાહેર ક્ષેત્રમાં ઉપલબ્ધ માહિતી ઉપર આધારિત છે. રોકાણકારોએ તેને રોકાણ સલાહ ગણવી જોઈએ નહીં. કૃપા કરીને તમારા તમામ રોકાણ નિર્ણય માટે તમારા નાણાકીય સલાહકારનો પરામર્શ કરો.
આ દસ્તાવેજ HSBC એસેટ મેનેજમેન્ટ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ (HSBC) દ્વારા માત્ર બજારનું વિવરણ પૂરું પાડવાના ઇરાદાથી માહિતીના હેતુસર જ તૈયાર કરવામાં આવ્યો છે અને તેને HSBC મ્યુચ્યુઅલ ફંડના કોઈપણ ફંડ ખરીદવા માટે દરખાસ્ત અથવા દરખાસ્તોના અગ્રહ ગણવો જોઈએ નહીં. આ દસ્તાવેજમાં (તૃતીય પક્ષકારો પાસેથી મેળવાયેલી હોય તે સહિત) સમાવિષ્ટ તમામ માહિતી સ્રોતો પાસેથી મેળવાયેલી છે, જેને HSBC/તૃતીય પક્ષકાર વિશ્વસનીય ગણે છે પરંતુ તેને HSBC/તૃતીય પક્ષકાર દ્વારા સ્વતંત્ર રીતે પ્રમાણિત કરવામાં આવેલી નથી. વધુમાં, HSBC કોઈ બાંહેધરી, સ્કૂઆત અથવા ખાતરી આપતું નથી અને આવી માહિતીની સચોટતા અથવા સંપૂર્ણતા સંબંધે કોઈ જવાબદારી અથવા ઉત્તરદાયિત્વ સ્વીકારતું નથી. દસ્તાવેજની અંદર સમાવિષ્ટ માહિતી અને અભિપ્રાય જાહેર રીતે ઉપલબ્ધ માહિતી ઉપર આધારિત છે અને કરવેરાના દરો પ્રસિદ્ધિના સમયે લાગુ પડે છે, જે સમયાંતરે ફેરફારને આધીન છે. અભિપ્રાયની અભિવ્યક્તિ માત્ર HSBCની છે અને કોઈપણ પૂર્વ જાણકારી અથવા નોટિસ વગર ફેરફારને આધીન છે. તેને ચોક્કસ રોકાણ ઉદ્દેશો, નાણાકીય પરિસ્થિતિ અને કોઈ વિશેષ વ્યક્તિની ચોક્કસ જરૂરિયાતો સાથે નિસ્પત નથી, જે આ દસ્તાવેજ મેળવી શકે છે. રોકાણકર્તાઓએ આ અહેવાલમાં ચર્ચાયેલી અથવા સૂચિત કરવામાં આવી હોય તેવી કોઈપણ સિક્યુરિટીઝ અથવા રોકાણ રણનીતિમાં રોકાણની ઉચિતતા સંબંધે નાણાકીય સલાહ મેળવવી જોઈએ અને સમજવું જોઈએ કે ભવિષ્યની સંભાવનાઓ વિશે વ્યક્ત કરેલા મંતવ્યો સાકાર થઈ શકે અથવા સાકાર ન પણ થઈ શકે. આ દસ્તાવેજ અથવા HSBC મ્યુચ્યુઅલ ફંડ બંનેમાંથી એકપણ કોઈ અધિકારક્ષેત્રમાં નોંધાયેલા નથી. કેટલાક અધિકારક્ષેત્રોમાં આ દસ્તાવેજનું વિતરણ નિયંત્રિત અથવા સંપૂર્ણપણે પ્રતિબંધિત હોઈ શકે છે અને તદનુસાર, જે આ દસ્તાવેજ જે વ્યક્તિના કબજામાં આવે છે તેમણે તે અંગે માહિતગાર હોવું અને આવા નિયંત્રણોનું અનુપાલન કરવું જરૂરી છે.
આ દસ્તાવેજનો ઇરાદો તેને માત્ર ભારતની અંદર ઉપલબ્ધ બનાવવાનો અને ભારતીય અધિકારક્ષેત્રમાં વિતરણ કરવા માટે મંજૂર કરાયેલો છે. કોઈપણ વ્યક્તિને આ દસ્તાવેજનું વિતરણ (રોકાણકર્તાઓ, સંભવિત રોકાણકર્તાઓ અને ડિસ્ટ્રિબ્યુટર સહિત) જે ભારત બહાર સ્થિત છે અથવા ભારતમાં વસતાં વિદેશી નાગરિકોને ચુસ્તપણે પ્રતિબંધિત છે. આ દસ્તાવેજ અથવા HSBC મ્યુચ્યુઅલ ફંડ બંનેમાંથી કોઈપણ કોઈ વિદેશી અધિકારક્ષેત્રમાં સિક્યુરિટીઝ કાયદા/નિયમોના અંતર્ગત નોંધાયેલા નથી. કેટલાક અધિકારક્ષેત્રોમાં આ દસ્તાવેજનું વિતરણ ગેરકાનૂની અથવા નિયંત્રિત અથવા સંપૂર્ણપણે પ્રતિબંધિત હોઈ શકે છે અને તદનુસાર, આ દસ્તાવેજ જો કોઈ વ્યક્તિના કબજા હેઠળ આવે છે તેમણે તે અંગે માહિતગાર હોવું અને આવા નિયંત્રણોનું અનુપાલન કરવું જરૂરી છે. જો કોઈ વ્યક્તિ ભારત સિવાય કોઈ અન્ય અધિકારક્ષેત્રમાં આ દસ્તાવેજ મેળવવાનું પસંદ કરે છે તો તે આમ તેના/તેણીના પોતાના જોખમ કરે છે અને HSBC અથવા તેની જૂથ કંપનીઓ આમ કરવાના પરિણામે આવી વ્યક્તિ દ્વારા આચરવામાં આવતા સ્થાનિક કાયદા અથવા નિયમોના કોઈપણ ઉલ્લંઘન માટે ઉત્તરદાયી ઠરશે નહીં.

© કોપિરાઇટ. HSBC એસેટ મેનેજમેન્ટ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ 2024, તમામ અધિકારો અબાધિત.
HSBC મ્યુચ્યુઅલ ફંડ, 9-11 માળ, NESCO - IT પાર્ક બિલ્ડિંગ 3, નેસ્કો કોમ્પ્લેક્સ, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, ગોરેગાંવ ઇસ્ટ, મુંબઈ 400063. મહારાષ્ટ્ર.
GST - 27AABCH0007N1ZS, ઇમેલ: investor.line@mutualfunds.hsbc.co.in | વેબસાઇટ: www.assetmanagement.hsbc.co/in